

ડાયરેક્ટ સેલ એજન્ટ ની નિમણૂક માટેની શરતો :-

- 1) બીજી કોઈ બંક માં ડીએસએ તરીકે ઓછા માં ઓછા એક વરસ થી કાર્યરત હોવા જોઈએ.
(નેશનલાઇઝ / પ્રાઇવેટ)
- 2) ક્રેડિટ સ્કોર મિનિમમ 750 કે વધુ હોવો જોઈએ.
- 3) કોઈ ક્રિમિનલ history કે નાણાકીય બાબતો એ તકરાર ન હોવા નું સોગંદનામું લેવું.
- 4) ઉમર 18 થી ઓછી નહીં.
- 5) કોર્પોરેટ ડીએસએ માટે ના અરજદાર હોય તો ક્રેડિટ સ્કોર ૧, ૨ અથવા ૩ હોવો જોઈએ.
- 6) સ્ટાફ ના સગાં સંબંધીની ડીએસએ તરીકે નિમણૂક કરવામાં આવશે નહીં.
- 7) બીજી કોઈ પણ નાણાકીય સંસ્થા ના મુદત વીતી ખાતેદાર ન હોવા જોઈએ.
- 8) વલસાડ જિલ્લા માં પોતા ના નામે સ્થાવર મિલકત ધરાવતા હોવા જોઈએ.
- 9) પે-આઉટ એક મહિનાનો અંતર રાખી ને પેમેન્ટ કરવા માં આવશે. (દા.ત. જાન્યુઆરી માસ માં કરેલ બિજનેસ નું પે-આઉટ માર્ચ મહિનાની ૧૦ તા. સુધી માં કરવા માં આવશે).
- ૧૦) બેન્ક અથવા ડીએસએ બે માંથી કોઈ પણ પાર્ટી એક માસની નોટિસ આપીને એગ્રીમેન્ટ ટર્મિનેટ કરી શકશે.
- ૧૧) બેન્ક નો લોગો કે બીજું કોઈ પણ સાહિત્ય પોતાના વ્યક્તિગત ફાયદા માટે ઉપયોગમાં લઈ શકશે નહીં.
- ૧૨) પે-આઉટ સિવાય બીજા કોઈ પણ પ્રકાર ના ખર્ચાઓ બેન્ક ભોગવશે નહીં.
- ૧૩) ડીએસએ એ માત્ર બેન્ક ના સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરશે અને ડીએસએ દ્વારા લાવેલ ફાઇલો કરવી કે નહીં તે બાબતે બેન્ક નો નિર્ણય આખરી રહેશે. લોન પ્રોસેસીંગ/ સેન્કસન વખતે DSA ની કોઈપણ પ્રકાર ની ભૂમિકા રહેશે નહીં.
- ૧૪) ડીએસએ જે તે શાખા માં લોન ફાઇલ જમા કરાવી ને લોગઇન બાબત ની પાવતી મેળવી લેવી.
- ૧૫) ખૂટતા ડોક્યુમેન્ટ્સની પૂર્તતા કરવા ની સંપૂર્ણ જવાબદારી જે તે ડીએસએ ની રહેશે. લોન અપ્રેઇસલ પ્રોસેસ માં ડીએસએ નો કોઈ રોલ રહેશે નહીં.
- ૧૬) માત્ર ડિસબર્સ થયેલા લોન કેસો પર જ પે-આઉટ આપવા માં આવશે.
- ૧૭) સંબંધિત માસ પત્યા પછી ડીએસએ એ ડિસબર્સ થયેલ કેસો ના પે-આઉટ માટેનું બિલ અને જે તે શાખા માં થી મેળવેલ લોગ-ઇન ની પાવતી સાથે હેડ ઓફિસ પર મોકલી આપવાનું રહેશે.
- ૧૮) ડીએસએ માટે અરજી કરનાર વ્યક્તિએ પોતાના કેવાયસી ડોક્યુમેન્ટ આપવા ના રહેશે.
- ૧૯) પે-આઉટ માટે એસબીપીપી બેન્ક માં કરંટ ખાતું ખોલાવવાનું રહેશે.
- ૨૦) બેન્ક સાથે બેન્ક ના ફોર્મટ માં એગ્રીમેન્ટ કરવા નું રહેશે.